

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટનને ફોર્સ દ્વારા 2020 માં કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ શહેરો પૈકી એક તરીકે ઓળખ આપવામાં આવી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 7, 2020) – જાન્યુઆરી 2020 માં, સીટી ઓફ બ્રેમ્પટનને ફોર્સ દ્વારા કેનેડામાં 300 ટોચના એમ્પ્લોયર્સની યાદી મુજબ, [વર્ષ 2020 માટે કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ](#) શહેરો પૈકી એક તરીકે ઓળખ આપવામાં આવી.

વર્ષ 2019 માં, સીટી ઓફ બ્રેમ્પટનને ફોર્સની યાદીમાં 66^{મું} ક્રમ મળ્યો હતો. જ્યારે 2020 માં, સીટીએ 300 માં 48^{મું} સ્થાન મેળવ્યું. યાદી પર ટોચની 50 સંસ્થાઓમાં માત્ર બે કેનેડિયન ગવર્નમેન્ટ સર્વિસ સંસ્થાઓમાંથી એક આ શહેર હતું, સીટી ઓફ ઓટાવાની સાથે સાથે.

ફોર્સ કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સના વાર્ષિક ક્રમાંકનમાં કર્મચારીઓને ગમતી શ્રેષ્ઠ કંપનીઓ ઓળખવા માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા (Statista) સાથે ભાગીદારી કરી.

પ્રતિભાવ આપનારાઓને અનામીપણે ક્રમાંકન કરવાનું કહેવામાં આવ્યું, શૂન્યથી 10 નાં માપ પર, તેઓ પોતાના એમ્પ્લોયર્સની ભલામણ અન્ય લોકોને કરે તેવી શક્યતા કેટલી છે. Statista (સ્ટેટિસ્ટા) દ્વારા ત્યાર પછી પ્રતિભાવ આપનારાઓને પોતાની સિવાયની બીજી સંસ્થાઓને નામાંકિત કરવાનું કહેવામાં આવ્યું. 8,000 કેનેડિયનોની મોજણી દ્વારા તૈયાર કરાયેલી, અંતિમ યાદી જેમાં ઓછામાં ઓછાં 500 કર્મચારીઓ ધંધાઓ માટે કાર્યરત હોય, સૌથી વધારે ભલામણ મેળવનાર 300 એમ્પ્લોયર્સનું ક્રમાંકન કરે છે.

ઝડપી હકીકતો

- નવેમ્બર 2019 માં, સીટી ઓફ બ્રેમ્પટનને પંચવર્ષીય કાર્યસ્થળે વિવિધતા અને સમાવેશ વ્યૂહરચના અને કાર્ય યોજના બનાવી. તે બહુ સર્વગ્રાહી સંસ્થાગત સંસ્કૃતિને પોષવાની તકો નિર્ધારિત કરે છે જે તેના લોકોને પ્રવૃત્તમય બનાવે, લોકોનો વિકાસ કરે અને લોકો સાથે ઉજવણી કરે, અને આ રીતે વૈવિધ્યસભર કાર્યબળને આકર્ષે.
- બ્રેમ્પટન સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકી એક અને કેનેડામાં 9^{મું} સૌથી મોટું શહેર છે.

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટન હાલના અને ભૂતપૂર્વ કર્મચારીઓ માટે પસંદગીનું એમ્પ્લોયર શહેર છે, અને તે બાબતને જાણતા લોકોને સીટી ઓફ બ્રેમ્પટન આપણાં સમુદાયના નિર્માણમાં મહત્વનું કામ કરે, તેમાં રસ છે. અમને ફોર્સ દ્વારા કેનેડાના ટોચના એમ્પ્લોયર્સ પૈકી એક તરીકે મળેલી ઓળખ માટે ગૌરવ છે!”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“સીટી ઓફ બ્રેમ્પટન કેનેડાના ટોચના એમ્પ્લોયર્સ શહેરો પૈકી એક છે અને બ્રેમ્પટન સૌથી વૈવિધ્યસભર સમુદાયો પૈકી એક છે. ગયા વર્ષે, અમે સંખ્યાબંધ નવી પહેલો શરૂ કરી જેમાં પંચવર્ષીય કાર્યસ્થળે વિવિધતા અને સમાવેશ વ્યૂહરચના અને કાર્ય યોજના સામેલ છે, જે અમારી સંસ્થાને અમારા સમુદાયની રચનાને (મોઝેઈકને) વધારે સારી રીતે પ્રતિબિંબિત કરવામાં મદદરૂપ થશે.”

- *હરકિરત સિંઘ (Harkirat Singh), અધ્યક્ષ, કોર્પોરેટ સેવાઓ; સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રેમ્પટન*

“અમે બ્રમ્પટનમાં ફેરફાર લાવી રહ્યા છીએ, દેશમાં સૌથી જુવાન, સૌથી ઝડપથી વિકસી રહેલ, સૌથી વૈવિધ્યસભર શહેરો પૈકી એક તરીકે. અમે ઊંચા લક્ષ્યો અને મોટા પાયે વિચારો ધરાવીએ છીએ, બ્રમ્પટનને ભવિષ્યના ઉભરી રહેલા વૈશ્વિક શહેર તરીકે સ્થાન અપાવવા. એ રોમાંચક બાબત છે કે ફોર્સે અમારી સંસ્થાને ઓળખ આપી છે, જે બ્રમ્પટન માટે રોજિંદા પરિણામો આપતા પ્રવૃત્તમય, ઉત્સાહિત અને સશક્ત કર્મચારીઓની અમારી કટિબદ્ધ ટીમને પ્રતિબિંબિત કરે છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca